

# Sample

05 Mar 1987

07:15 AM


Jeypore

तिथि 05/03/1987 समय 07:15:00 वार गुरुवार स्थान Jeypore चित्रपक्षीय अयनांश : 23:40:37  
अक्षांश 18:52:00 उत्तर रेखांश 82:38:00 पूर्व मध्य रेखांश 82:30:00 पूर्व स्थानिक संस्कार 00:00:32 घंटे

पंचांग	अवकलडा चक्र
साम्प्रतिक काल : 18:04:40 घं	गण : मनुष्य
वेदान्तर : 00:11:41 घं	योनि : गज
सूर्योदय : 06:16:31 घं	नाडी : मध्य
सूर्यास्त : 18:05:58 घं	वर्षा : क्षत्रिय
चैत्रादि संवत् : 2043	वश्य : यतुष्पाद
शक संवत् : 1908	वर्ग : भृग
भास : फाल्गुन	युँज : पूर्व
पक्ष : शुक्ल	हंसक : अग्नि
तिथि : 6	जन्म नामाक्षर : ले-लेभपाल
नक्षत्र : भरणी	पाया (रा.-न.) : यांटी-स्वर्षा
योग : ऐन्द्र	होरा : गुरु
करण : क्रौलव	चौघडिया : शुभ

विंशोत्तरी	योगिनी
शुक्र 5वर्ष 4मा 13दि	भद्रिका 1वर्ष 4मा 3दि
राहु	भद्रिका
18/07/2015	08/07/2019
17/07/2033	07/07/2024
राहु 30/03/2018	भद्रिका 18/03/2020
गुरु 23/08/2020	उल्का 16/01/2021
शनि 30/06/2023	सिद्धा 06/01/2022
बुध 16/01/2026	संकटा 16/02/2023
केतु 03/02/2027	मंगला 08/04/2023
शुक्र 03/02/2030	पिंगला 18/07/2023
सूर्य 29/12/2030	धान्या 17/12/2023
चंद्र 29/06/2032	भ्रामरी 07/07/2024
मंगल 17/07/2033	

ग्रह	व	अ	अंश	राशि	नक्षत्र	पद	स्वामी	अं.	स्थिति	घटभल	चर	स्थिर	ग्रह तारा
लग्न			07:48:46	मीन	उ.भाद्रपद	2	शनि	केतु	---	0:00			
सूर्य			20:16:24	कुम्भ	पू.भाद्रपद	1	गुरु	गुरु	शत्रु राशि	1.19	भ्रातृ	पितृ	साधक
चंद्र			23:05:13	मेघ	भरणी	3	शुक्र	शनि	सम राशि	1.17	अमात्य	मातृ	जन्म
मंगल			14:53:27	मेघ	भरणी	1	शुक्र	शुक्र	स्वराशि	1.38	मातृ	भ्रातृ	जन्म
बुध	व	अ	09:35:27	कुम्भ	शतभिषा	1	राहु	गुरु	सम राशि	1.20	पुत्र	ज्ञाति	प्रत्यारि
गुरु			06:52:00	मीन	उ.भाद्रपद	2	शनि	बुध	स्वराशि	1.42	कलत्र	धन	वध
शुक्र			08:21:49	मकर	उत्तराषाढा	4	सूर्य	शुक्र	मित्र राशि	1.02	ज्ञाति	कलत्र	सम्पत्
शनि			26:55:11	वृश्चि	ज्येष्ठा	4	बुध	गुरु	शत्रु राशि	0.99	आत्मा	आयु	मित्र
राहु			18:06:07	मीन	रेवती	1	बुध	बुध	सम राशि	---		ज्ञान	मित्र
केतु			18:06:07	कन्या	हस्त	3	चंद्र	बुध	शत्रु राशि	---		भोक्ष	विपत्



## સાડાસાતી – માર્ગદર્શન

ચંદ્રમા ભ્રમણ ને લીધે જન્મ કુંડળીમાં જ્યારે ગોચરવશ શનિ ની સ્થિતિ બારમાં, પહેલા અથવા બીજા સ્થાન માં આવે ત્યારે એને સાડાસાતી કહેવાય છે. શનિ ની ચંદ્ર થી ચોથા અથવા આઠમાં ભાવમાં સ્થિતિ ને અઢી વર્ષ ની પનોતી કહેવાય છે. સાડાસાતી ની અસર સાત વર્ષ તથા (ઢેયા) અઢી વર્ષ ની પનોતી અસર (ઢેયા) અઢી વર્ષ સુધી રહેશે. આ વખતે તેમને સાધારણ રીતે શારીરિક, માનસિક અથવા આર્થિક રીતે દુઃખ મળે છે. પરંતુ કોઈક વાર આ દશા ખૂબજ આશ્ચર્યકારક પ્રગતિ પણ કરી આપે છે.

સાધારણ રીતે સાડાસાતી માણસ ના જીવનમાં ત્રણ વાર આવે છે. પહેલાં તે બાળપણ માં, બીજી યુવાની માં અને ત્રીજી વૃદ્ધાવસ્થામાં આવે છે. પહેલી સાડાસાતી ની અસર અભ્યાસ પર તથા માં-બાપ પર પડે છે બીજી સાડાસાતી ની અસર કાર્યક્ષેત્ર, આર્થિક સ્થિતિ તથા પરિવાર ઉપર પડે છે. પરંતુ ત્રીજી સાડાસાતી ની અસર તબીયત પર પડે છે. નીચે લખેલી સૂચિ માં સાડાસાતી નો તથા દરેક અઢી વર્ષની પનોતી નો સમય તથા શુભ અશુભ ફળ વિશે જણાવેલું છે.

### પ્રથમ ચક્ર:

આઠમાં સ્થાનસ્થ ઢેયા:	05/03/1987-17/12/1987	-----	-----
પનોતીની પહેલી ઢેયા:	02/06/1995-10/08/1995	16/02/1996-17/04/1998	-----
પનોતીની બીજી ઢેયા:	17/04/1998-07/06/2000	-----	-----
પનોતીની ત્રીજી ઢેયા:	07/06/2000-23/07/2002	08/01/2003-07/04/2003	-----
ચોથી સ્થાનસ્થ ઢેયા:	06/09/2004-13/01/2005	26/05/2005-01/11/2006	10/01/2007-16/07/2007

### દ્વિતીય ચક્ર:

આઠમાં સ્થાનસ્થ ઢેયા:	02/11/2014-26/01/2017	21/06/2017-26/10/2017	-----
પનોતીની પહેલી ઢેયા:	29/03/2025-03/06/2027	03/06/2027-23/02/2028	-----
પનોતીની બીજી ઢેયા:	03/06/2027-03/06/2027	23/02/2028-08/08/2029	05/10/2029-17/04/2030
પનોતીની ત્રીજી ઢેયા:	08/08/2029-05/10/2029	17/04/2030-31/05/2032	-----
ચોથી સ્થાનસ્થ ઢેયા:	13/07/2034-27/08/2036	-----	-----

### તૃતીય ચક્ર:

આઠમાં સ્થાનસ્થ ઢેયા:	11/12/2043-23/06/2044	30/08/2044-08/12/2046	-----
પનોતીની પહેલી ઢેયા:	14/05/2054-02/09/2054	05/02/2055-07/04/2057	-----
પનોતીની બીજી ઢેયા:	07/04/2057-27/05/2059	-----	-----
પનોતીની ત્રીજી ઢેયા:	27/05/2059-11/07/2061	13/02/2062-07/03/2062	-----
ચોથી સ્થાનસ્થ ઢેયા:	24/08/2063-06/02/2064	09/05/2064-13/10/2065	03/02/2066-03/07/2066

### શનિ પનોતી નું ફળ

#### પનોતી નો પ્રકાર

આઠમાં સ્થાનસ્થ ઢેયા:
પનોતીની પહેલી ઢેયા:
પનોતીની બીજી ઢેયા:
પનોતીની ત્રીજી ઢેયા:
ચોથી સ્થાનસ્થ ઢેયા:

#### ફળ

સમ
સમ
અશુભ
શુભ
સમ

#### ક્ષેત્ર

બદનામી
સ્વાસ્થ્ય
ધન
પરાક્રમ
સન્તાતિ કષ્ટ

## સાડાસાતી નો ઉપાય

શનિ ની સાડાસાતી ની અશુભ અસરોને ઓછી કરવા માટે દાન, પૂજા, ઉપવાસ, મંત્ર વિગેરે કરી શકાય. શનિવારે કાળો કામળો, અડદની દાળ, કાળા-તલ, ચામડાની ચપ્પલ, કાળું કપડું, અનાજ, તલ અને તેલ દાન કરવું જોઈએ.

શનિ દેવ ની પૂજા કરવી જોઈએ તથા શનિવારે ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસમાં અળદની દાળથી બનાવેલી વસ્તુ, ચણા, ચણાની લોટ, કાળા તલ, સંચળ અને ફળ ખાવા જોઈએ. આ ઉપરાંત પોતે અથવા કોઈ સારા બ્રાહ્મણ થી શનિના નીચે લખેલો મંત્ર ૧૯,૦૦૦ વાર જપ કરવા જોઈએ.

**ૐ પ્રૌ પ્રી પ્રૌ સઃ શનૈશ્ચરાય નમઃ ॥**

શનિની સાડાસાતી માં શારીરિક, માનસિક, પારીવારિક શાંતિ સમૃદ્ધિ તથા આર્થિક રીતે સદ્ધર બનવા અને પોતાના કામમાં પ્રગતિ કરવા માટે નીચે લખેલા મહામૃત્યુંજય મંત્રના ૧,૨૫,૦૦૦ વાર પોતે અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણ થી જપ કરાવવા જોઈએ.

**ૐ ત્રયંબકમ યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ॥  
ૐ વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય માઽમૃતાત ॥**

આ ન થાય તો નીચે લખેલો મંત્ર રોજ ૧૦૮ વાર જપવા જોઈએ.

**ૐ હૌ જૃં સઃ ૐ ભૂર્ભુવ સ્વઃ ૐ ॥**

શનિના સાડેસાતીનાં સારા ફળોમાં વધારો કરવા માટે ૫-૧/૪ રત્તી નીલમ લઈને પંચઘાતુ (સોનું, ચાંદી, તાંબુ, લોખંડ અને જસત) માં અથવા તો ઘોડાની નાળ કે નૌકા ની ખીલી માંથી બનાવેલી લોખંડની વીટી અથવા પેન્ડન્ટ પહેરવું જોઈએ. વીટી જમણા હાથની વચલી આંગળીમાં પહેરવી.

વીટી અથવા પેન્ડન્ટ પહેરતાં પહેલાં તેને શ્રી હનુમાન ચાલીસા તથા શ્રી હનુમાન અષ્ટક વાંચીને મઘ અને કાચા દૂધ થી ચાર વખત અભિષેક કરીને, શુદ્ધ જળથી ધોઈને, સૂર્યાસ્ત પછી ધારણ કરવું.